

EPFO વિશ્વાસ યોજના, 2026

1. વિશ્વાસ યોજના, 2026 શું છે?

આ EPFO દ્વારા લાવવામાં આવેલી એક વખતની (One Time) 6 મહિનાની વિશેષ યોજના છે.

આ યોજનાનો હેતુ EPF મોડું ભરવાના કારણે લાગતા **Penalty (Damages)** ને ઓછા દરે ભરીને કેસનો નિકાલ કરવાનો છે.

નોંધ:

આ યોજના માત્ર **Damages (Penalty)** માટે છે.

PF Contribution અને Interest માં કોઈ રાહત નથી.

2. યોજના કેટલા સમય માટે લાગુ રહેશે?

- શરૂઆતની તારીખથી 6 મહિના સુધી.
- જરૂર પડે તો વધુમાં વધુ 6 મહિના સુધી વધારી શકાય છે.

3. કયા કેસોમાં યોજના લાગુ પડે છે?

નીચેના કેસો માટે લાભ મળશે:

- ✓ Damages નો Order આવ્યો છે અને કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
- ✓ Damages નો Order આવ્યો છે પરંતુ હજુ Recovery થઈ નથી.
- ✓ Damages ની Notice મળી છે પરંતુ Final Order આવ્યો નથી.
- ✓ હજુ Notice પણ બહાર પડી નથી.

4. કયા કેસોમાં યોજના લાગુ પડતી નથી?

નીચેના કેસોને લાભ નહીં મળે:

- ✗ Damages સંપૂર્ણ વસૂલ થઈ ગયા હોય.
- ✗ Fraud, ગેરવહીવટ અથવા ખોટા રેકૉર્ડનો કેસ હોય.
- ✗ Interest સંપૂર્ણ ભર્યું ન હોય.

નોકરીદાતા (Employer) માટે

5. Damages ના નવા દર કેટલા છે?

PF મોડું ભરવાનો સમય	Damages
2 મહિનાથી ઓછું	દર મહિને 0.25%
2 થી 4 મહિના	દર મહિને 0.50%
4 મહિના અથવા વધુ	દર મહિને 1.00%

6. અરજી કેવી રીતે કરવી?

Employer એ

- EPFO Employer Portal માં Login કરવું.
- **Vishwas, 2026** વિકલ્પ પસંદ કરવો.
- જરૂરી દસ્તાવેજો Upload કરીને અરજી કરવી.

7. કયા દસ્તાવેજો જરૂરી રહેશે?

સામાન્ય રીતે:

- Damages ની Notice અથવા Order
- જો કેસ કોર્ટમાં હોય તો તેની વિગતો
- Challan અથવા Payment Details
- જરૂરી Undertaking

8. નવી ગણતરી (Recalculation) કેવી રીતે જાણવા મળશે?

EPFO તપાસ કર્યા પછી

Employer Portal પર નવી ગણતરી (Revised Damages) બતાવશે.

9. નવી રકમ કેટલી અંદર ભરવી પડશે?

સામાન્ય રીતે

15 દિવસની અંદર.

જો 15 દિવસમાં શક્ય ન હોય તો Extension માટે અરજી કરી શકાય છે.

10. સમયસર પૈસા નહીં ભરો તો શું થશે?

- અરજી રદ થઈ જશે.
 - વિશ્વાસ યોજનાનો લાભ નહીં મળે.
 - જૂની કાર્યવાહી ફરી ચાલુ રહેશે.
-

11. Vishwas Certificate શું છે?

ચુકવણી પૂર્ણ થયા પછી EPFO

Digital Vishwas Certificate આપશે.

આ Certificate દ્વારા

- કોર્ટ કેસ પાછો ખેંચી શકાય.
 - Settlement નો પુરાવો મળશે.
-

12. શું Contribution અથવા Interest માફ થશે?

ના.

માત્ર Damages માં રાહત મળશે.

PF Contribution અને Interest સંપૂર્ણ ભરવાના રહેશે.

EPFO ઓફિસ માટે

13. અરજી કોણ તપાસશે?

સંબંધિત

Regional Office અથવા District Office

વિશેષ Vishwas Module દ્વારા અરજીની તપાસ કરશે.

14. Damages ની નવી ગણતરી કેવી રીતે થશે?

EPFO ની Computer System દ્વારા.

સામાન્ય રીતે Manual Calculation નહીં થાય.

15. Manual Calculation ક્યારે થશે?

માત્ર ખાસ પરિસ્થિતિમાં,

જ્યારે જૂની ગણતરીમાં ફેરફાર થયો હોય.

અંતિમ ગણતરી System દ્વારા જ થશે.

16. Appeal માટે અગાઉ ભરેલી રકમનું શું?

જો Appeal માટે EPFO માં Pre-deposit ભરેલી હશે તો

તે રકમનો લાભ આપવામાં આવશે.

- ઓછી રકમ હશે તો બાકી ભરવી પડશે.
- વધારે હશે તો બીજા કેસમાં Adjust થઈ શકે.

17. EPFO સિવાય બીજી જગ્યાએ ભરેલી Pre-deposit માન્ય રહેશે?

ના.

માત્ર EPFO માં ભરેલી રકમ જ માન્ય ગણાશે.

18. Certificate મળ્યા પછી શું થશે?

- Damages સંબંધિત Appeal સમાપ્ત થશે.
- કોર્ટ અથવા CGIT માં કેસ પાછો ખેંચી શકાશે.

19. Employer નવી ગણતરી સ્વીકારશે નહીં તો?

- અરજી નિષ્ફળ ગણાશે.
- જૂની કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે.

20. EPFO યોજના પર કેવી રીતે નજર રાખશે?

EPFO પાસે Dashboard રહેશે જેમાં

- કેટલી અરજીઓ આવી
- કેટલી મંજૂર થઈ
- કેટલી નામંજૂર થઈ
- કેટલી વસૂલાત થઈ

તેની માહિતી ઉપલબ્ધ રહેશે.

21. શું યોજના સતત ચાલુ રહેશે?

ના.

આ મર્યાદિત સમય માટેની યોજના છે.

સામાન્ય રીતે સમયવધારો આપવામાં આવતો નથી.

22. કર્મચારીઓના હિતને કોઈ અસર થશે?

બિલકુલ નહીં.

કર્મચારીઓના PF સંબંધિત તમામ હક્કો સંપૂર્ણ સુરક્ષિત રહેશે.

આ યોજના માત્ર Employer પર લાગતા **Damages (Penalty)** ઘટાડવા માટે છે.

મુખ્ય મુદ્દાઓ (Quick Summary)

-  માત્ર **Damages (Penalty)** માં રાહત.
-  PF Contribution અને Interest માં કોઈ માફી નહીં.
-  અરજી માત્ર **EPFO Portal** પરથી કરવી.
-  ચુકવણી સમયસર કરવી જરૂરી.
-  ચુકવણી પછી **Vishwas Certificate** મળશે.
-  Certificate મળ્યા પછી સંબંધિત Damages કેસનો નિકાલ થઈ શકે છે.

EPFO VISHWAS 2026 Scheme

Which Cases Are Covered?

The scheme covers a wide range of pending cases involving delayed EPF contributions. Employers may apply if their case falls under any of the following categories:

- Cases pending before a court or tribunal after a damages order has already been passed.
- Cases where a final damages order exists but recovery has not been completed.
- Cases where EPFO has issued a show-cause notice but the final order is yet to be passed.
- Cases where no notice has been issued yet, even though delayed remittance has occurred.

This broad coverage means employers can seek settlement even before formal adjudication begins in certain cases.

Scheme Conditions

Employers cannot simply opt for reduced damages. Certain mandatory conditions must be fulfilled before an application is accepted.

These include:

- Payment of 100 per cent of the applicable interest under Section 7Q before applying.
- Submission of an online application through the EPFO Employer Portal.
- Authentication using a Digital Signature Certificate (DSC) or e-signature.
- A written undertaking that no appeal or fresh legal proceeding will be filed after the dispute is settled.
- Payment under the scheme within 15 days of approval by the competent authority.

After verification by the concerned regional office, an approval certificate will be made available in the employer's login.

Which Cases Are Not Eligible?

The scheme does not apply in every situation. EPFO has specifically excluded:

- Cases where damages have already been fully recovered.
- Cases involving fraud, embezzlement or deliberate falsification of records.
- Cases where the employer has not paid the entire interest amount before applying.
- Employers falling under these categories will have to continue under the existing legal process.

What Happens To Pending Litigation?

One of the primary objectives of VISHWAS 2026 is to reduce litigation between employers and the EPFO.

Once a settlement is approved under the scheme, the employer must withdraw or discontinue any appeal relating to the dispute and cannot initiate fresh proceedings over the same dues. The EPFO will also take steps for disposal or withdrawal of pending matters wherever applicable.

Concessional Penalty Rates

For delays that occurred before June 14, 2024, damages will be calculated at concessional monthly rates under the scheme:

- 0.25% per month for delays of up to two months.
- 0.50% per month for delays of more than two months but less than four months.
- 1% per month for delays exceeding four months.

These rates are substantially lower than the normal damages that may otherwise be imposed under the EPF law.